



B-1601210202010402 Seat No. _____

B. A. (Sem. I) Examination

March - 2021

Philosophy

(Philosophy of Yoga)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (1) બધા પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) કોઈપણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપો.

- 1 પતંજલીનો અષ્ટાંગયોગ સમજાવો.
- 2 સત્કાર્યવાદ સમજાવો.
- 3 યોગદર્શનમાં સમાધિ સમજાવો.
- 4 યોગમાં કૈવલ્ય સમજાવો.
- 5 યોગમાં ઈશ્વરનું સ્થાન વર્ણવો.
- 6 યોગમાં પુરુષનો ખ્યાલ સમજાવો.
- 7 યોગ તત્ત્વમીમાંસા સમજાવો.
- 8 યોગમાં વિત્તૂતિ સમજાવો.
- 9 ટૂંકનોંધ લખો :
 - (1) યોગમાં વૃત્તિ
 - (2) યોગમાં વૈરાગ્ય
- 9 ટૂંકનોંધ લખો :
 - (1) ક્રિયાયોગ
 - (2) યોગની વ્યાખ્યા

ENGLISH VERSION

- Instructions :** (1) All questions carry equal marks.
(2) Answer any five questions.

- 1 Explain Paranjali's Astang Yoga.
 - 2 Explain Satkaryaveda.
 - 3 Explain Samadhi in yoga darshana.
 - 4 Explain Kaivalya in yoga.
 - 5 Describe the place of God in yoga.
 - 6 Explain concept of purusha in yoga.
 - 7 Explain yoga antology.
 - 8 Explain vibhuti in yoga.
 - 9 Write short notes :
 - (1) Vrutti in yoga
 - (2) Vairagya in yoga
 - 10 Write short notes :
 - (1) Kriya yoga
 - (2) Definition of yoga.
-